

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૮/૦૭/૨૦૧૭ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા :-

સમાચાર યાદી નં.૧૫૩૪/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૯ કેસ કરી ૩૫ વ્યક્તિઓને ઝડપી, ૩૧૯ લીટર દેશી દારૂ, ૧૭ બોટલ ઈંગ્લીશ દારૂ, ૮૦ બિયર ટીન, ૧ રિક્ષા અને ૧ સ્કુટર કબજે કર્યું હતું તેમજ જુગાર ધારા હેઠળ ૭ કેસ કરી ૩૪ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૮૮,૪૪૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૫૩૫/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૬૧ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૨૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ધરફોડ:-

સમાચાર યાદી નં.૧૫૩૬/૧૭

ચાંદખેડા: ભાવેશસિંહ ચંદ્રપાલસિંહ (રહે. ધરતી બંજોઝ ત્રાગડ રોડ ચાંદખેડા) એ તા.૨૮/૭/૧૭ નારોજ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૬/૭/૧૭ બપોરના ૪/૦૦ થી તા.૨૭/૭/૧૭ સવારના ૯/૦૦ વાગ્યા દરમિયાન પોતાના મકાનનામાં અજાણી વ્યક્તિ પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના, તથા કાંડા ઘડિયાળ નંગ-૨ અને રોકડ રૂપિયા ૬૦૦૦/- મળી કુલ રૂપિયા ૭૩,૦૦૦/- મત્તાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.એમ.વાઢેર ચલાવે છે.

વટવા: સુભાષચંદ્ર અલગુપાન્ડે (રહે. સત્યમ સાગર ટેનામેન્ટ જય અંબે માતાના મંદીરની સામે વિઝોલ કોસીંગ રોડ વટવા) એ તા.૨૮/૭/૧૭ નારોજ વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૪/૭/૧૭ થી તા.૨૭/૭/૧૭ સવારના ૯/૦૦ વાગ્યા દરમિયાન પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના, એલ.ઈ.ડી.ટી.વી., પંખો, ટીપોઈ તથા કપડા મળી કુલ રૂપિયા ૭૯,૫૦૦/ મત્તાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી બી.જી.વસાવા ચલાવે છે.

ગાયકવાડ હવેલી: મુસ્તકીમ નજરમહમદ શેખ (ઉ.વ.૪૫) (રહે.ખીસકોલાની પોળ ગુલાબબાઇ હોસ્પિટલ પાછળ કાલુપુર) તા.૨૮/૭/૧૭ કલાક ૯/૩૦ વાગ્યાના સુમારે જમાલપુર રાયખડ ઘંટીવાળા મહોલ્લા પાસે સીંગચણાની ભઠીની લાઈટ ચાલુ કરવા સ્વીચ ચાલુ કરવા જતા જમણા હાથે વિજ કરંટ લાગ્યો હતો. સારવાર માટે વા.સા.હોસ્પિટલ લઇ જતા ફરજ પરના ડૉ.શ્રી મૃતજાહેર કર્યા હતા. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી પન્નાલાલ બદાભાઇ ચલાવે છે.

જીઆઈડીસી વટવા: દિનેશભાઈ જગદીશભાઈ ભાવસાર (ઉ.વ.૩૩) (રહે. શ્યામવેદ બંડ્લોઝ ગેરતપુર) તા.૨૮/૭/૧૭ સવારના ૧૦/૦૦ વાગ્યાના સુમારે ફેઝ-૧ ઈન્ડો પાવર એન્જિનિયરીંગ કંપનીમા ઓફિસનું ફર્નીચર બંધ પાવરમા હટાવતી વખતે ઓફિસના ટેબલ સાથે એક્શન ઇલે.બોર્ડ વાયરીંગ ને અડી જતા કરંટ લાગ્યો હતો. સારવાર માટે મણીનગર સરદાર હોસ્પિટલ લઇ જતા ફરજ પરના ડૉ.શ્રી મૃતજાહેર કર્યા હતા. આ અંગે જીઆઈડીસી વટવા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી ભગાવનસિંહ પર્વતસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.